

૧) સાફલ્ય ગાથા (ફોટાઓ સાથે)

૨) સુરક્ષા સેતુ અંતર્ગત થયેલ કાર્યક્રમો તથા તેને અનુરૂપ ફોટાઓ વિગત સ્કુલોમાં અવેરનસ

પ્રેસનોટ

સગીર વયની કિશોરીનું કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી છેલ્લા ૧૧ મહિનાથી નાસતા-ફરતા આરોપીને છોટા ઉદેપુર જીલ્લાના અંતરિયાળ વિસ્તારમાંથી ઝડપી લઇ કિશોરીનું તેણીના માતા-પિતા સાથે મેળાપ કરાવતી વાંસદા પોલીસ ટીમ :

તા.૭/૧/૨૦૧૭

વાંસદા પો.સ્ટે. 1st ગુ.ર.નં. ૩૩/૧૬, IPC કલમ ૩૬૩ મુજબના ગુનાના કામે ગત તા.૯/૨/૧૬ ના રોજ એક સગીર વયની કિશોરી ઉ.વ.૧૭, નું કોઇ અજાણ્યો ઇસમ વાંસદા ખાતેથી કાયદેસરના વાલીપણા માંથી અપહરણ કરી નાસી ગયેલ. સદર ગુનાની તપાસ દરમિયાન આરોપી તથા કિશોરી હાલમાં છોટા ઉદેપુર જીલ્લાના બોડેલી તાલુકાના વાઘવા ગામે હોવાની મળેલ હકિકત આધારે મે.પોલીસ અધિક્ષક સા.શ્રી નવસારી નાઓનું જરૂરી માર્ગદર્શન મેળવી તાત્કાલિક વાંસદા પોલીસ ટીમ દ્વારા છોટા ઉદેપુર જીલ્લાના વાઘવા ગામે પહોંચી જરૂરી ખાત્રી તપાસ કરતાં ભોગ બનનાર કિશોરી તથા આરોપી મળી આવતાં, તેઓને વાંસદા પો.સ્ટે. લાવી, જરૂરી કાર્યવાહી કરી, મહીલા સુરક્ષા સમિતી વાંસદાના સભ્ય તથા પો.સ્ટે.ના મહીલા કોન્સ્ટેબલ દ્વારા કિશોરીનું જરૂરી કાઉન્સેલીંગ કરાવી, કિશોરીનું તેણીના માતા-પિતા સાથે મેળાપ કરાવવામાં સફળતા મળેલ છે. તથા ભોગ બનનાર કિશોરીના નિવેદન આધારે સદર ગુનાના કામે IPC કલમ ૩૬૬, ૩૭૬ તથા જાતીય ગુનાઓ સામે બાળકોને રક્ષણ આપતો અધિનિયમની કલમ- ૬ નો ઉમેરો કરી આરોપી નિલેશ રમેશભાઈ રાઠવા, ઉ.વ.૨૧, રહે.વાઘવા-સાંગણકુવા ફળીયા, તા.બોડેલી, જી.છોટાઉદેપુર વાજાને આજરોજ કલાક ૧૨/૫૦ વાગ્યે અટક કરવામાં આવેલ છે. તથા આગળની તપાસ જે.વી.ચાવડા સિની.પો.સ.ઇ. નાઓ કરી રહેલ છે.



પ્રેસનોટ

તા.૦૬/૦૧/૨૦૧૭

નાસતા ફરતા આરોપીની ધરપકડ કરતી નવસારી એસ.ઓ.જી. ટીમ

પોલીસ અધિક્ષકશ્રી એમ.એસ.ભરાડા સાહેબ નવસારી નાઓએ જીલ્લાના નાસતા ફરતા આરોપીઓને પકડવા સુચના આપતા.પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એસ.બી.શેખ એસ.ઓ.જી. નવસારી નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ નવસારી જીલ્લાના નાસતા ફરતા આરોપીઓની તપાસ કરવા સુચના આપતા આજરોજ તા.૦૬/૦૧/૨૦૧૭ ના રોજ અ.હે.કો.જયેશભાઈ ગોવીંદભાઈ તથા પો.કો.આલાભાઈ સવશીભાઈ નાઓને સંયુક્ત રીતે ખાનગી રાહે બાતમી ફકીકત મળેલ કે, નવસારી રૂરલ પો.સ્ટે. થર્ડ ગુ.ર.નં.૨૦૦/૨૦૧૬ પ્રોહી એક્ટ કલમ ૬૬(૧)બી, ૬૫એ.ઇ.૧૧૬(૨).૮૧,૯૮,૯૯ મુજબના ગુનાનો નાસતો ફરતો આરોપી જીતેશભાઈ ઉર્ફે જયેશભાઈ ઉર્ફે ટીકો રમણભાઈ વસાવા રહે,અંદારા ગામ, કેલાશ ટેકરી,મંદીર ફળીયા,તા.અંકલેશ્વર જી.ભરૂચનો મળેલ બાતમી ફકીકત આધારે અંદારા ગામ, વાઘી રોડ ખાતે આવનાર છે.જે મળેલ બાતમી ફકીકત આધારે વોચમાં રહેતા તે મળી આવતા તેને નવસારી એસ.ઓ.જી.ઓફીસે લાવી નામકામ પુછતા તેણે પોતાનું નામ જીતેશભાઈ ઉર્ફે જયેશભાઈ ઉર્ફે ટીકો રમણભાઈ વસાવા રહે,અંદારા ગામ, કેલાશ ટેકરી,મંદીર ફળીયા,તા.અંકલેશ્વર જી.ભરૂચનો તોફમતદાર ઉપરોક્ત ગુનામાં નાસતો ફરતો હોય. જેથી તેને સી.આર.પી.સી. કલમ ૪૧(૧)આઇ મુજબ આજરોજ તા.૦૬/૦૧/૨૦૧૭ ના કલાક ૨૧/૦૦ વાગે અટક કરેલ છે. અને આરોપીને અટક કર્યા અંગે સ્ટે.ડા.માં નોંધ કરી આગળની વધુ કાર્યવાહી અર્થે નવસારી રૂરલ પોલીસ સ્ટેશન નાઓને સુપ્રત કરેલ છે.

મુદા નંબર (૧)

1. જીલ્લા શહેર કક્ષાએ કોઈ ખોવાયેલ બાળકો માટે ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હોય, કે અન્ય સારી કામગીરી માટે ઝુંબેશ.
- નવસારી જીલ્લા પોલીસ ધ્વારા વર્ષ ૨૦૦૭ થી આજદિન સુધીના ગુમ થયેલ બાળકો/વ્યક્તિઓ શોધવા અંગે મીસીંગ ડ્રાઇવનું આયોજન કરી સગા સબંધીનો સંપર્ક કરી શોધવાની કામગીરી કરવામાં આવે છે.
- ગુમ/અપહરણ થયેલ બાળકોની ભારત સહકાર ધ્વારા શરૂ કરવામાં આવેલ વેબસાઇટ <http://trackthemissingchild.gov.in/missing/index.php> ઉપર રોજ રોજ એન્ટ્રી કરવામાં આવે છે.
- પી.સી.આર. વાન ચીખલી, બીલીમોરા, નવાસરી ટાઉન વિસ્તાર, નવસારી ડુરલ, જલ્લાલપોર વિસ્તારમાં તાલીમ બંધ ડ્રાઇવરો તેમજ પોલીસ કર્મચારીઓ મુકી શરૂ કરી ૧૦૦ નંબર પર કોલ કરવાથી હેલ્પ મળી રહે.
- ગુમ થયેલ બાળકો અંગે જીલ્લાની મહીલા સુરક્ષા સમિતીની મહીલાઓ તેમજ એન.જી.ઓ. યાઇલ્ડ વેલ્ફેર ઓફીસર તેમજ જીલ્લાના તમામ અધિકારીઓ સાથે મીટીંગો કરવામાં આવે છે.

મુદા નંબર (૩)

- ટ્રાફિક અંગેના કાર્યક્રમો હાથ ધરવામાં આવેલ હોય.
- ટ્રાફિક અવેરનસ અંગે શાળા કોલેજોમાં કાર્યક્રમો કરવામાં આવે છે.
- ટ્રાફિક જનજાગૃતિ અંગે ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી ટ્રાફિકના નિયમો સાથેની જાહેર જગ્યાઓ તેમજ શાળા કોલેજોમાં આર.ટી.ઓની મદદથી અવેરનસ કાર્યક્રમો રાખવામાં આવેલ.
- વારંવાર રોડ ઉપર ટ્રાફિક ડ્રાઇવ રાખી ટ્રાફિક અવેરનસ અંગેની સમજ આપવામાં આવે છે.

મુદા નંબર (૪)

- ગુનાઓ અટકાવવા કોઈ વિશિષ્ટ કામગીરી/સ્ટ્રેટેજી અપનાવવામાં આવેલ છે ?
- નેશનલ ૮ તેમજ અન્ય રસ્તાઓ ઉપર એક્સીડન્ટ ઝોન નક્કી કરી રોડ એક્સીડન્ટ, ટ્રાફિક નિયમન, કાયદો અને વ્યવસ્થાની જાળવણી સારુ સી.સી.ટી.વી. કેમેરાની જરૂરીયાત મુજબની યાદી બનાવી કલેક્ટરશ્રી સાથે મિટીંગો કરવામાં આવેલ છે.
- નેશનલ હાઇવે નંબર ૮ ઉપર નાઇટ રાઉન્ડ દરમિયાન સેક્ટરવાઇઝ ક્રોસ પેટ્રોલીંગ કરવામાં આવે છે. હોટલો, ઢાબા, તેમજ વાહનોનું ચેકીંગ સઘન બનાવવામાં આવેલ છે.
- વારંવાર કોમ્પીંગ નાઇટ રાખી શક પડતા ઇસમો, અવાવરુ જગ્યા, રેલવે સ્ટેશન, હોટલ ધાબા, વાહન ચેકીંગ તેમજ નાકાબંધી રાખવામાં આવેલ છે.
- ક્રાઇમ ઇન્સ્વેસ્ટીંગ અંગે પોલીસના માણસોને સેમિનાર યોજી ગુનાઓ અટકાવવા તેમજ ઇન્સ્વેસ્ટીંગમાં અવેરનસ આવે તે સારુ સેમિનારો યોજમાં આવે છે. ક્ષમતા વિકાસનું દરેક પોલીસ સ્ટેશન લેવલે આયોજન કરવામાં આવે છે.

મુદા નંબર (૫)

- અન્ય લોકહિતની બાબતો જે લોકોના તુરતજ ધ્યાન પર આવે તેવી બાબતો.
- સુરક્ષા સેતુ સોસાયટીના ભાગરૂપે એસ.પી.સી. ના બાળકોને વિવિધ પ્રકારની તાલીમ કેમ્પ, સેમિનારનું આયોજન કરવામાં આવે છે.